

VOL. No. 02 ISSUE No. 6 JUNE 2016 PRICE 30/-



બાળકો અને નવયુવાનો માટે

રમઝાનુલ મુબારક, હિજરી સન ૧૪૩૭
જૂન - ૨૦૧૬

અંક - ૬



વહાલા બાળકો !

અસ્સલામો અલયકુમ !

અલ્લાહનું ઘર ખાનએ કાઅબા છે. અલ્લાહની કિતાબ (પુસ્તક) કુરઆન છે. અલ્લાહનો દીન ઈસ્લામ છે. તેવી જ રીતે અલ્લાહનો મહીનો રમઝાનુલ મુબારક છે.

રમઝાનુલ મુબારકનો મહીનો રોજા રાખવાનો-ઈબાદતોનો અને કલામે પાકની તિલાવત કરવાનો મહીનો છે. અમે પણ આ બાબતો વિશે તમારા માટેની જાણકારી અને અન્ય ઘણી વસ્તુઓ એકત્ર કરી છે.

બંદગીના આ માસમાં ખુદાએ ભુખ્યા અને તરસ્યા રહેવાને પોતાની સાચી બંદગી ગણી છે.

આ મહીનામાં જ શબે કદ્ર આવે છે. શબે કદ્રમાં લવહે મહેફૂઝ ઉપર કુરઆન ઉતારવામાં (નાઝિલ કરવામાં- લખવામાં) આવ્યું છે અને ઈમામતના સિલસિલાની બીજી કડી - રસુલે સકલૈન (સ.અ.વ.)ના ફરઝન્દની મુબારક વિલાદતે તો રમઝાન માસની મહાનતામાં અનેકગણો વધારો કરી દીધો છે.

પરંતુ ઓગણીસમી, વીસમી અને એકવીસમી તારીખોને પણ ભૂલવી જોઈએ નહીં. આ ગમના દિવસો છે. ઓગણીસમીએ આપણાં મૌલાને વાર કરવામાં આવ્યો જેને કારણે એકવીસમી એ આપની શહાદત થઈ ગઈ હતી. આ દિવસોમાં બીજી ઈબાદતો સાથે ઈમામના શોકમાં શરીફ થવાનું અને ગમ મનાવવાનું ભૂલતાં નહીં.

અને આ મહીનો ખતમ થયા પછી તરત જ આપણાં માટે ઈદની મહાન ભેટ પણ આવશે જ.

વહાલા મિત્રો! અમને અને આપના હાદીને પોતાની ખુશીઓમાં ભૂલી જતાં નહીં, હોં!

વસ્સલામ



ઝેરે સરપરસ્તી હઝરતો હુજજત

અરવાહોના ફિદાહ, અજજલલ્લાહો તઆલા ફરજહુશરીફ

મહુમ જનાબ મૌલાના આબીદ હુસૈન રીઝવી
સાહેબની યાદમાં

મુખ્ય તંત્રી :

સૈયદ મોહમ્મદ રેઝા રિઝવી ગરવી

કાર્યવાહક તંત્રી :

સૈયદ મોહમ્મદ અજર

સૈયદ આબીદ હુસૈન એ રિઝવી 7383560072

સહાયકો :

અહમદ રેઝા મુરારહ

તાલીમ રેઝા અજમેરી

એહસાન અલી રિઝવી

અનુવાદક :

સૈયદ મોહમ્મદ ફાઝિલ બુખારી આઈ. એ. એસ (નિવૃત્ત)

શુષોભન :

Web Graphics મોહમ્મદ તાહીર

9898937633 E-mail: smtahir202@gmail.com

ટુરીંગ એજન્ટ :

સૈયદ મીસમ મેહદી રિઝવી 9510344219

“હાદી” માસિકના મેમ્બર બનવા માટે સંપર્ક કરો:

અમદાવાદ: (૧) શબ્બીર ભાઈ નુરાની, ફોન: ૯૩૭૬૧૬૮૩૦૬
(૨) મૌલાના ઝફરુલ હસન, ફોન: ૯૩૨૭૫૩૬૬૩૮
(૩) ઝાકીર ભાઈ મોમીન, ફોન: ૯૩૨૭૦૪૧૩૧૪

ભાવનગર: મુસ્તાકભાઈ વિરાણી, ફોન: ૯૮૨૪૫૩૮૧૧૪

મહુવા: મહેદીરઝા એમ. બંભોરા, ફોન: ૯૮૨૪૩૨૭૨૨૭

કાણોદર: નૌશાદભાઈ, જાફરી ચેનલ, ફોન: ૯૮૮૮૭૭૩૬૧૧

મેતા: મોહસીનભાઈ કદાવાલ, ફોન: ૯૮૮૮૩૬૮૦૮૮

ભરૂચ: મુશ્તાકઅલી પાનવાલા, ફોન: ૯૮૨૪૨૪૩૦૫૧

ઘોળકા: કમરઅલી મોમીન

અંજાર: રફીકભાઈ ખોજા, ફોન: ૯૮૨૫૩૧૮૬૨૧

રૂસ્તમપૂરા: સૈયદ આશીક હુસૈન, ફોન: ૯૮૨૪૧૧૮૩૭૨

રાજૂલા: મૌલાના હસન મહેદી, ફોન: ૯૮૦૪૧૪૬૧૧૦

સેલવાસા: ગુલામ અબ્બાસભાઈ દેવજાણી, ફોન: ૯૮૨૫૮૮૮૮૭૮

સિહોર: હસનઅલી વજીરઅલી વસાયા, ફોન: ૯૮૭૮૮૬૮૮૬૮

કચ્છ: મુશ્તાક હુસૈન અબ્દુલ હુસૈન માસ્ટર, ફોન: ૯૮૨૪૨૧૬૪૭૦

ડેડીયાપાડા: રિઝવાન હુસૈન અમીરઅલી રાજાણી, ફોન: ૯૪૨૭૧૭૫૨૩૧

ખાસ નોંધ: સભ્ય તથા એજન્ટ મિત્રોને નમ્ર અરજ છે કે જેનું અગાઉનું લવાજમ બાકી છે તે અને નવા વર્ષનું લવાજમ મોકલી આપવા વિનંતી.

વિગતો માટે સંપર્ક :

(રહ.)

હૌઝએ ઈલમીયહ ઈમામ ખુમૈની ગોલ્ડન પાર્ક, વટ્પા, અમદાવાદ, ગુજરાત, ભારત

E-mail: hadimasik@yahoo.com Website: www.hadikids.org

PHONE NO: 079-25892786, 94266 78614, 70969 21472, 97247 37865

વાર્ષિક લવાજમ: રૂપિયા ૩૦૦/-

3 HADI, JUNE 2016


નમાઝના દસ ફાયદાઓ

નબીયે અકરમ સ.અ.વ. એ ફરમાવ્યું છે કે:
નમાઝ દીન (ધર્મ)નો સ્તંભ છે અને તેના દસ ફાયદાઓ છે:

૧. નમાઝ મુખની શોભા છે.
૨. નમાઝ હૃદયના માટે પ્રકાશ અને નૂર છે.
૩. નમાઝ શરીરને શાંતિ આપે છે.
૪. નમાઝ કબરમાં પ્રેમાળમિત્ર અને સહાયક છે.
૫. નમાઝ (ખુદાની) દયા-કૃપાનું કારણ બને છે.
૬. નમાઝ આકાશનો દીવો છે.
૭. નમાઝ સદ્કાર્યો (આઅમાલ)ના ત્રાજવાના પલ્લા ભારે કરી દે છે.
૮. નમાઝ ખુદાની પ્રસન્નતાનું કારણ બને છે.
૯. નમાઝનો લાભ જન્નત રૂપે મળશે.
૧૦. નમાઝ જહન્નમની સામે ટાલ બને છે.

જે વ્યક્તિ નમાઝ અદા કરે છે તે જાણે કે દીનની સ્થાપના કરે છે અને જે નમાઝને તજી દે છે તે જાણે દીનને વેરાન કરી દે છે.

(કિતાબે નસાએહ, પાન નં ૩૦૬)



જતાબ લુકમાનની શિખામણો

(ક્રમશઃ ચાલનાર લેખમાળા)

મુખારવિલ્લ

હે મારા વત્સ! પોતાના મુખ ઉપર પડદો ન નાખી રાખો કેમકે તે રાત્રે બીજાઓ માટે ડરી જવાનું કારણ બને છે ને દિવસે તમને (પોતાને) અપમાનિત કરે છે.

(કળ્લુલ-ઉમ્માલ, ભા ૧૫, પા ૩૦૮, હ ૪૧૧૪૯)

જ્ઞાનના ફાયદા


હે મારા પુત્ર! જ્ઞાનીઓ અને વિદ્વાનોની સોબતમાં બેસવાનું રાખો કેમકે ખુદાવળે આલમ મન (હૃદય)ને (તેમ કરવાથી) ડહાપણના પ્રકાશથી (એવી જ રીતે) જીવિત કરી દે છે કે જે રીતે પૃથ્વીને વરસાદ થકી જીવિત (નવપલ્લવિત) કરી દે છે.

(બિહારૂલ અનવાર, ભા ૧, પા ૨૦૪, હ ૨૨)

અહલેબૈત અ.સ. પ્રત્યે હૃદયમાં પ્રેમભાવ પેદા કરવાના ઉપાયો

૭. અહલેબૈત અ.સ. પ્રત્યેના પ્રેમના મહત્વને
જાહેર કરતાં રહો:-

લોકોને જે બાબત પ્રત્યે આકર્ષવામાં આવે છે અને જે બાબતના આદરની તેમને શીખ આપવામાં આવે છે તે બાબત પ્રત્યે લોકો આદર અને શ્રદ્ધા રાખતાં થઈ જાય છે. સમાજમાં જે બાબતને મહત્વ આપવામાં આવે છે તે બાબત પ્રત્યે લોકો આકર્ષિત થવા લાગે છે અને પોતે તેના પક્ષમાં છે - તે બાબતમાં શ્રદ્ધા રાખે છે, તે વાતનો ગર્વ સાથે સ્વીકાર કરવા લાગે છે. તેથી જરૂરી છે કે સમાજમાં આપણે એવા વાતાવરણનું સર્જન કરીએ કે જો કોઈ વ્યક્તિ અહલેબૈત અ.સ.ની પ્રશંસામાં કોઈ પંક્તિ રચે -તેવી પંક્તિ સંભળાવે- તે અંગેની પંક્તિઓ કંઠસ્થ કરે, તેમની કોઈ હદીસ યાદ કરી લે, તેઓ વિશેનું કોઈ પુસ્તક વાંચે, તેઓનાથી સંબંધિત કોઈ પ્રસંગ લખે, કોઈ





ફિલ્મ બનાવે, કોઈ ઘોષણાં તૈયાર કરે એટલે સુધી કે તેનું નામ કોઈ ઈમામના નામ સાથે સામ્ય ધરાવતું હોય- અથવા તે પોતાના કોઈ બાળકનું નામ અહલેબૈત અ.સ.ના ઈમામો પૈકી કોઈ ઈમામના નામ ઉપરથી રાખે તો તે પોતાના તેવા કાર્ય માટે ગર્વ કરતો થઈ જાય.

અહલેબૈત અ.સ. પ્રત્યેનો પ્રેમ ખુદાની ખાસ દયા-કૃપા છે. જે તેના પાત્ર વ્યક્તિઓના હૃદયમાં જ જન્મે છે. ઈમામ રિઝા અ.સ.નું કથન છે કે: “ખુદા જેને પસંદ કરે છે તેને અમારા પ્રેમ પ્રત્યે પ્રેરિત કરે છે.” (બિહારુલ અનવાર, ભાગ ૧૬, પા ૩૫૬)

ઈમામ જાઅફરે સાદિક અ.સ. એ શિખામણ આપી છે કે: “અમારા પ્રત્યેના પ્રેમભાવને તુચ્છ અને ઓછું આંકશો નહીં કેમકે એ સદાને માટે પુણ્ય આપનાર કાર્યો પૈકી છે.” (બિહારુલ અનવાર, ભાગ ૨૩, પા ૨૫૦)



અહલેબૈત અ.સ. પ્રત્યેના પ્રેમના વિરોધનું વાતાવરણ સર્જનાર શત્રુઓના કાવત્રાઓ પ્રત્યે પણ આપણે સાવધ




રહેવું જોઈએ અને એવા દરેક પ્રયત્નનો શક્ય તેટલી બધી શક્તિથી સામનો કરવો જોઈએ.

શામના હાકેમે હઝરત અલી અ.સ.ના એક ચાહક અબુલ-અસ્વદ દોઝેલીને ત્યાં મધ મોકલ્યું કે મધનો સ્વાદ ચાખીને તેમના મનમાં શામના હાકેમ માટે પ્રેમ ઉભરાઈ જાય. તે વખતે ઘરમાં તેમની દીકરી પણ હાજર હતી, તેમણે મધનો સ્વીકાર કર્યો પરંતુ જ્યારે દીકરીને એમ લાગ્યું કે ખલીફાએ તેમને ત્યાં મધ એટલા માટે મોકલ્યું છે કે તેમના મનમાં અહલેબૈત અ.સ. પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ જાય તો તે દીકરીએ ચાખેલું મધ થુકી નાંખ્યું અને મધ ચાટીને આલે અલી અ.સ.ના પ્રેમથી વંચિત થઈ જવું સ્વીકાર્યું નહીં.

અહલેબૈત અ.સ.ના ચાહકોનું એટલું બધું મહત્વ છે કે કયામતના દિવસે હઝરત ફાતેમા ઝહરા સલા. શીઆઓના ગુનાહો બખ્શવાની ભલામણ કરશે અને જે લોકોની ભલામણ કરવામાં આવી હશે તે લોકો પોતાની



بِغَارِ صَلَوَات



تو دل انور
تو دل انور
تو دل انور
تو دل انور
تو دل انور
تو دل انور
تو دل انور
تو دل انور

A decorative illustration of a flowering branch, likely a cherry blossom, with pink blossoms and green leaves. The branch curves upwards from the bottom left towards the top right. The background is a solid yellow color, and a thick black vertical line runs down the center of the image, partially obscuring the branch.



કરતાં રહો:-


બાળકો અને નવયુવાનો સમક્ષ તેમના વડીલો, માત-
પિતા અને ગુરુજનો અહલેબૈત અ.સ. પ્રત્યેના પ્રેમની
બાબતે જે પ્રકારનું વર્તન દાખવે છે, બાળકો અને
નવયુવાનો પણ તે રીતે જ એમનું અનુકરણ કરે છે;
આદરપૂર્વક માન સાથે અઈમ્મા અ.સ.નું નામ લેવું,



તેમનું નામ ઉચ્ચારતાં સમયે દુરુદ અને સલામ મોકલવું, ઈમામે ઝમાના અજ.નું નામ લેતી વખતે ઉભા થઈ જવું અને માથે હાથ મૂકી લેવું, અઈમ્મા અ.સ.ના વિલાદતના દિવસોએ ખુશાલી મનાવવી, એમની વફાત કે શહાદતના દિવસોમાં શોક મનાવવો અને તે દિવસે -એ દિવસો દરમિયાન- કોઈ મનોરંજન અને ખુશાલીના કાર્યો ન કરવા - એવા કાર્યો છે જેની બાળકો અને નવયુવાનો ઉપર દુરોગામી અસર થાય છે અને આવી બાબતોમાં બાળકો પોતાના વડીલોના વર્તનનું અવલોકન કરતાં રહે છે અને અનુકરણ કરે છે.

આ પરિસ્થિતિ એક શીઆની વિશિષ્ટતા છે. કેમકે એક પ્રખ્યાત હદીસમાં છે કે: “અમારા શીઆઓ અમારી વધેલી માટીમાંથી ઘડવામાં આવ્યાં છે. (તેથી) તેઓ અમારી ખુશીમાં ખુશી અનુભવે છે અને અમારા શોકમાં શોકમગ્ન થાય છે.”





અહલેબૈત અ.સ.ના પુણ્યશાળી નામો ઉપરથી પોતાના બાળકોના નામ રાખવાથી આ નામો થકી આ દુન્યાની બરકતો પ્રાપ્ત થાય છે અને આખેરતના ફાયદા પણ છે. આ પ્રકારના નામ રાખવા સબંધે ખુબ જ તાકીદ કરવામાં આવી છે અને આવા નામોના કારણે બાળકોના વ્યક્તિત્વના ઘડતર પર જે અસર થાય છે તે આ પુણ્યશાળી હસ્તીઓ સાથેના પ્રેમભાવ અને શ્રદ્ધા પેદા કરવાની બાબતે ઘણી અસરકારક નીવડે છે.



અધિતીય શાસન માટે હઝરત સુલૈમાન અ.સ.ની દુઆ

“رَبِّ اغْفِرْ لِي وَهَبْ لِي مُلْكًا لَا يَنْبَغِي لِأَحَدٍ مِّنْ بَعْدِي إِنَّكَ أَنْتَ الْوَهَّابُ”

“રબ્બિગફિર-લી-વ-હબ્લી મુલ્કલ-લાયમ્બગી લેઅહદિમ-મિંમબાઅદી
ઈન્નકા અન્તલ-વહ્હાબ” (સૂરએ સાદ, આ ૩૫)

અલ્લાહ તઆલાએ
હઝરત સુલૈમાન અ.સ.ની
પરીક્ષા લેવા માટે તેમના
સિંહાસન ઉપર એક જુવ
વગરનું શરીર નાંખી દીધું.
આ જુવ વગરના શરીર વિષે
વિવિધ મંતવ્યો છે.

કેટલાંક લોકોનું મંતવ્ય
એવું છે કે જનાબ સુલૈમાન
અ.સ.ને પોતાને ભયંકર
બીમારીમાં સપડાવીને

સિંહાસન ઉપર નાંખી દેવામાં
આવ્યાં હતાં અને આ તેમના
દ્વારા થઈ ગયેલ કોઈ
કર્તવ્યને અદા કરવામાં થઈ
ગયેલ સંકોચ (તર્કે ઊલા)નું
પરિણામ હતું.

કેટલાંકનું મંતવ્ય એવું છે
કે તેમણે પોતાની રીતે જ
પોતાના ઉત્તરાધિકારીની
વ્યવસ્થા કરવાના પ્રયત્નો
આરંભી દીધાં હતાં અને



એવી ઈચ્છા વ્યક્ત કરી કે એક શુરવીર- સમર્થ સંતાન પ્રાપ્ત થાય જેથી તે શાસન ચલાવવાના અને ખાસ કરીને અલ્લાહના કાજે ધર્મયુધ્ધ (જિહાદ) કરવાના કાર્યો કરી શકે.

આપની ઘણી પત્નિઓ હતી. જનાબ સુલૈમાન અ.સ.એ તેમના સામિપ્યનો નિશ્ચય કર્યો જેથી વધારે સંતાનોનો જન્મ થાય પરંતુ “ઈન્શા અલ્લાહ” કહેવાનું ચૂકી ગયાં તેથી તે સમયગાળામાં કોઈ સંતાનનો જન્મ થયો જ નહીં અને એક અપૂર્ણ નિષ્પ્રાણ શરીર અવતર્યું જેને જનાબ સુલૈમાન અ.સ.ના સિંહાસન ઉપર નાંખી દેવામાં આવ્યું તે પછી તેમણે ખુદાની બારગાહમાં દુઆ ગુજારી:

“રબ્બિગફિર - લી - વ - હબ્લી મુલ્કલ - લાયમ્મગી લેઅહદિમ - મિંમબાઅદી ઈન્નકા અન્તલ - વહ્હાબ” (સૂરએ સાદ, આ ૩૫)

અર્થાત: “હે મારા પાલનહાર! મને ક્ષમા પ્રદાન કર અને મને એવું સામ્રાજ્ય આપ જે મારા સિવાય બીજા કોઈને મળ્યું ન હોય અને ખરેખર તું જ સૌથી મહાન દાતા છે.”

અલ્લાહ તઆલાએ તેમની યાચના સ્વીકારી અને સમગ્ર સૃષ્ટિને તેમના તાબે કરી દીધી અને જનાબ સુલૈમાન અ.સ.ના સામ્રાજ્યની મહાનતા આજે પણ અદ્વિતીય છે.



આપણાં નબી સ.અ.વ.ના

સદ્ચારિત્રના દ્રષ્ટ્યંતો

(ક્રમશઃ ચાલનાર લેખમાળા)

સંતો અને દરિદ્રો જેવું જીવન:-

તફસીરે શૈખ અબુલ ફતૂહ (રહ)માં છે કે: “આપ સ.અ.વ. પોતાની દુઆમાં ફરમાવતાં હતાં કે હે ખુદા મને દરિદ્રોની જેમ જીવતો રાખ, મને સંતો જેવું મૃત્યુ આપ અને (કયામતના દિવસે) મને દરિદ્રો સાથે રાખજે.” (અલ-મુસ્તદરક, હદીસ ૭૨૦૩, ફૈઝુલ-કદીર, હદીસ ૨૧૦૩)

ઝકાત લેતી વખતની દુઆ:-

આ પુસ્તકમાં જ છે કે જ્યારે આપ સ.અ.વ.ની સેવામાં કોઈ વ્યક્તિ ઝકાત લઈને હાજર થતો તેના માટે આપ સ.અ.વ. આવી રીતે દુઆ કરતાં હતાં: “હે ખુદા! ફલાણાંનાં વંશજો (આલ) અને તેના કુટુંબ ઉપર દયા-કૃપા ફરમાવજે!” (અલ-મુસ્તદરક, હદીસ ૭૧૩૬)

ત્રણ વખત દોહરાવવું:-

જ્યારે આપ સ.અ.વ. કોઈ વાત કહેતાં અને કોઈ વ્યક્તિ પ્રશ્ન કરતો ત્યારે (જવાબને) ત્રણ વખત દોહરાવતાં હતાં જેથી કરીને વાત તદ્દન સ્પષ્ટ થઈ જાય અને બીજાઓ પણ આપ સ.અ.વ. પ્રત્યે ધ્યાન આપી શકે. (મકારેમુલ અખ્લાક, પા ૨૦)

(સુનનુન્નાબી નામના પુસ્તકમાંથી ચુંટી કાઢેલું)

ચાર સમસ્યાઓ



એક વ્યક્તિ ઈમામ અલી અ.સ. પાસે આવ્યો અને તેણે કહ્યું:
મારી ચાર સમસ્યાઓ છે, તેના જવાબ આપો.

ઈમામ અલી અ.સ. એ ફરમાવ્યું: ચાર તો શું, ચાલીસ હોય તો
પણ જણાવો, હું તેના જવાબ આપીશ.

આવનારે પુછ્યું:

“વાજિબ શું છે અને વધારે વાજિબ શું છે?”

“નજીક શું છે અને વધારે નજીક શું છે?”

“આશ્ચર્યજનક શું છે અને સૌથી વધારે આશ્ચર્યજનક શું છે?”

“મુશ્કેલ શું છે અને વધારે મુશ્કેલ શું છે?”

ઈમામ અ.સ. એ તેના ચારેય પ્રશ્નોના આ પ્રમાણે જવાબ
આપ્યા:

૧. અલ્લાહની આજ્ઞાઓનું પાલન કરવું તે વાજિબ છે અને
ગુનાહોથી બચીને રહેવું તે વધારે વાજિબ છે.
૨. કયામત પાસે છે અને મૃત્યુ વધારે પાસે છે.
૩. આ જગત આશ્ચર્યજનક છે અને આ જગતની લાલસા
રાખવી તે સૌથી વધારે આશ્ચર્યજનક છે.
૪. કબરમાં (સુવું) જવું તે મુશ્કેલ છે અને તૈયારી વગર
(નજાતના સામાન વગર) કબરમાં જવું તે વધારે મુશ્કેલ છે.

(કિતાબે નસાએહ, પા ૧૮૫, હ ૧૦૮)

ખાદ્ય પદાર્થો અને તેના ગુણધર્મો

(ક્રમશઃ ચાલનાર લેખમાળા)



ખજૂર



ખજૂર માનવશરીરમાં નવી માંસપેશીઓ તૈયાર કરે છે. એનો ગર્ભ (માવો) હાડકાને મજબૂત કરે છે. તેની છાલ શરીરની ચામડીને મજબૂતાઈ આપે છે. તેમ જ ફેફસાને ઉષ્ણતાં અને જઠરને સાફ કરવાનું કામ કરે છે. હરસ-મસા અને અતિમુત્રતાના રોગને અટકાવે છે. પીંડીઓને મજબૂત બનાવે છે અને રક્તપિત્તને જડ-મૂળમાંથી નષ્ટ કરવાનું કાર્ય કરે છે.

(કાફી, ભા ૬, પા ૩૬૧, હ ૧)



અંજૂર

નખીયે અકરમ સ.અ.વ. એ ફરમાવ્યું છે કે:

“અંજૂર ખાવાનું રાખો; લીલા એન સૂકા બંને પ્રકારના - કેમકે તેનાથી શરીરમાં શક્તિ આવે છે. હરસ-મસાને જડમૂળમાંથી નષ્ટ કરે છે અને સાંધાના દુખાવાને મટાડે છે. મનને શાંત રાખે છે.”

(મકારેમુલ અખલાક, પા ૧૭૪)





દૂધ



આ હદીસ વર્ણવનાર અબુલ-હસન ઇસ્ફહાની કહે છે કે:
અમે લોકો ઈમામ સાદિક અ.સ.ની સેવામાં હતાં ત્યારે એક
વ્યક્તિએ અરજ ગુજારી: “મૌલા! મારા પ્રાણ આપના ઉપર
ન્યોછાવર થાય! હું મને મારા શરીરમાં ઘણી અશક્તિ લાગે
છે.”

ઈમામે સાદિક અ.સ. એ ફરમાવ્યું: “દૂધનો પ્રયોગ કરતાં
રહો. તેનાથી શરીરમાં નવા સ્નાયુઓ બને છે અને આનાથી
હાડકાં મજબૂત થાય છે.”

(કાફી, ભા ૬, પા ૩૨૬, હ ૭)




દ્રાક્ષ



ઈમામ સાદિક અ.સ. એ ફરમાવ્યું છે કે:

“નબીયોમાંથી એક નબી અ.સ.એ અલ્લાહની બારગાહમાં
પોતે સંતાપ અને દુખથી પીડાતાં હોવાની ફરિયાદ કરી ત્યારે
તેમને આજ્ઞા મળી કે દ્રાક્ષ ખાવાનું રાખો (તેથી) દુઃખ અને
સંતાપમાંથી મુક્તિ મળશે.”

(કાફી, ભા ૬, પા ૩૫૧, હ ૪)



સંતાનોના નામ રાખવા વિશે

પોતાના સંતાનોના નામ તેમના જન્મ પહેલાંથી રાખી દો. તમો જાણતાં નથી કે પુત્ર થશે કે પુત્રી તો નામ એવી રીતે રાખી લો કે જે દીકરા માટે પણ યોગ્ય હોય અને દીકરી માટે પણ યોગ્ય હોય કેમકે જે બાળક મૃતાવસ્થામાં જન્મે છે તે બાળક કયામતના દિવસે પોતાના પિતાને પુછશે કે માંડું નામ કેમ રાખ્યું નહોતું? તેથી જ પયગમ્બરે અકરમ સ.અ.વ. એ જનાબ ફાતેમા સલા.ના જે બાળક આપ સલા.ના ગર્ભમાં જ પડી ગયેલ હતાં તેમનું પણ નામ રાખ્યું હતું અને તે પુત્રનું નામ “મોહસિન” રાખ્યું હતું કે જેમને માતાના ગર્ભમાં જ શહીદ કરી નાંખવામાં આવ્યાં હતાં. (ફુરુએ કાફી, ભા ૬, પા ૧૮)

બાળકોના શુભ (નેક) અને સારા નામ રાખવા તે માત-પિતાનું કર્તવ્ય છે. તેથી કહેવામાં આવ્યું છે કે મનુષ્યે પોતાના સંતાનની બાબતમાં સૌથી પ્રથમ જે શુભ કાર્ય કરવું જોઈએ તે તેનું શુભ નામ રાખવું તે છે અને તે તમારું (માત-પિતાનું) કર્તવ્ય છે કે પોતાના સંતાનોના શુભ નામ રાખે. (ફુરુએ કાફી, ભા ૬, પા ૧૮)





બાળકોના નામાંકરણ માટેના સર્વશ્રેષ્ઠ નામો અલ્લાહના નેકનામો (અસ્માએ હુસ્ના) અને આપણાં માઅસૂમીન અ.સ.ના નામો અને તેમના પવિત્ર આદરણીય સંતાનોના નામો અને તેમના લકબો છે. આપણાં નબી સ.અ.વ. એ ફરમાવ્યું છે કે જો કોઈ વ્યક્તિને ચાર પુત્ર હોય અને તે ચારમાંથી એકના નામને મારા નામ ઉપરથી ન રાખે તો જાણે કે મારો હક ઓળવી લીધો. (ફુરએ કાફી, ભા ૬, પા ૧૯)

અને હદીસમાં એવું પણ વર્ણન થયેલ છે કે જે ઘરમાં મુહમ્મદ, અહેમદ, અલી, હસન, હુસૈન, જાઅફર, તાલિબ, અબ્દુલ્લાહ અને ફાતિમા અ.સ.ના નામે કોઈ હોય છે તે ઘરમાં દરિદ્રતા પ્રવેશી શકતી નથી. (ફુરએ કાફી, ભા ૬, પા ૩૦)

પોતાના સંતાનોના સારા નામ રાખવા તે સંતાનોનો તેમના માત-પિતા ઉપરનો અધિકાર છે. એક વ્યક્તિએ પોતાના પુત્ર વિશે નબીયે અકરમ સ.અ.વ.ને પુછ્યું: “હે રસૂલુલ્લાહ! આ બાળકનો મારા ઉપર કોઈ અધિકાર છે?” ત્યારે આપ સ.અ.વ. એ ફરમાવ્યું: “હા- તેનું સારું નામ રાખો, તેનો ઉછેર-પ્રશિક્ષણ સારી રીતે કરો અને તેના માટે યોગ્ય ધંધો-રોજગાર પણ શોધતાં રહો.” (ફુરએ કાફી, ભા ૬, પા ૪૮)

પુદાના ક્રોધ અને પ્રસન્નતાની નિશાનીઓ

પયગમ્બરે અકરમ સ.અ.વ. એ
ફરમાવ્યું છે કે:
લોકો ઉપર અલ્લાહની પ્રસન્નતાની
નિશાની એ છે કે ન્યાયપૂર્ણ શાસનની
સ્થાપના થાય છે
અને વસ્તુઓનો ભાવ ઘટી જાય છે
અને પુદાના ક્રોધની નિશાની એ છે
કે લોકો ઉપર અત્યાચારીઓ
શાસન કરવા લાગે છે
અને મોંઘવારી વધી જાય છે.
(તહેઝીબુલ-અહેકામ, ભા ૭, પા ૧૫૮;
ફુરુએ કાફી, ભા ૫, પા ૧૬૨)

શાસનની પડતીની નિશાનીઓ

ઈમામ અલી અ.સ. એ ફરમાવ્યું છે કે:
ચાર બાબતો એવી છે કે જે દેખાય તો
તે શાસનની પડતી સૂચવે છે:

૧. જ્યારે સિધ્ધાંતો અને કાયદા
કાનૂનોને નષ્ટ કરી દેવામાં આવે છે.

૨. જ્યારે શાસનમાં
અભિમાન આવી જાય છે.

૩. જ્યારે નિમ્ન શ્રેણીના અને
લાયકાત વગરના લોકોને


મહત્વ આપવામાં આવતું થઈ જાય.

૪. જ્યારે લાયક અને કાબેલ લોકોને
પાછળ ધકેલી દેવામાં આવે.

(ગોરૂલ હેકમ, ભા ૬, પા ૩૧૧૦)



સમૃદ્ધ થઈ જવાના નુસ્ખા



(નહજુલ બલાગાહના પ્રકાશમાં)

આજે લોકો એવું જ વિચારતાં થઈ ગયાં છે કે ધન-દોલત, બરકતો, નેઅમતો, સંતાન, હોદ્દો એ તમામ બાબતોમાં સમૃદ્ધ થઈ જઈએ અને સમૃદ્ધ રહીએ. પરંતુ આ બાબતે એટલે કે ખરેખર દરેક રીતે સમૃદ્ધ થઈ જવાની બાબતે ન તો કોઈ સાચી દિશામાં પ્રયત્ન કરે છે કે ન તો કોઈ તે સમૃદ્ધીની પ્રાપ્તિની સાચી રીત- સાચી પદ્ધતિ દર્શાવે છે પરંતુ આપણાં અઈમ્મએ માઅસૂમીન અ.સ. એવા છે કે જેમણે આપણને કોઈ પણ બાબતે નિરાશ નથી કર્યા; દરેક રોગ, દરેક આવશ્યકતા, દરેક સમસ્યાનું સમાધાન અને ઈલાજ આપણાં માઅસૂમીન અ.સ. પાસે છે. આવો, આજે આપણે ઈમામ અલી અ.સ.ના સંબોધનો, પત્રો અને ખાસ ડહાપણ અને માર્ગદર્શનવાળા પુસ્તક “નહજુલ બલાગાહ”ના પ્રકાશમાં સમૃદ્ધ થવાના ચાર નુસ્ખાઓની જાણકારી મેળવીને આપણાં જીવનમાં અજમાવવા પ્રયત્ન કરીએ:

૧. આજીવિકાની યાચના માત્ર ખુદાવન્દે આલમ સમક્ષ કરો:

ઈમામ અલી અ.સ.એ નહજુલ બલાગાહમાં આજીવિકામાં બરકત અને વૃદ્ધિ માટે દુઆ ફરમાવીને આપણને અલ્લાહ સમક્ષ જ આજીવિકાની યાચના કરવાની તાકીદ કરી છે. આપ દુઆ આવી રીતે કરતાં હતાં કે: “હે ખુદા! મારા માટે વરસાદ, બરકત, આજીવિકા અને તારી દયા-કૃપાના દ્વાર ખોલી દે.”

(નહજુલ બલાગાહ, હદીસ ૧૪૩)

૨. પ્રથમ પ્રાયશ્ચિત (તોબા) કરવી:

આજીવિકા અને રોજની વૃદ્ધિની અત્યંત મહત્વની શરત પ્રાયશ્ચિત કરીને આજીવિકાની યાચના કરવી તે છે. તેથી જ ઈમામ અ.સ. એ ફરમાવ્યું છે કે: “ખુદાવન્દે આલમ પોતાના બંદાઓને તેમના દુષ્ટ ચારિત્ર વખતે તેમની આજીવિકામાં ઘટાડો કરીને, બરકતોને તેમનાથી દૂર કરીને અને દાનના દ્વાર તેમના માટે બંધ કરી દઈને તેમની કસોટી કરે છે જેથી કરી પ્રાયશ્ચિત કરવાવાળાઓ પ્રાયશ્ચિત કરી લે, ગુનાહો કરનારાઓ પોતાના ગુનાહોની માફી માંગી લે અને બોધપાઠ મેળવનાર બોધપાઠ મેળવી લે. ખુદાવન્દે આલમે પ્રાયશ્ચિતને લોકો માટે તેમની આજીવિકા અને તેમના પ્રત્યે પોતાની દયા-કૃપાનું કારણ બતાવેલ છે.” (નહજુલ બલાગાહ, હદીસ ૧૪૩)

૩. પોતાની પાસેથી બીજાઓને આપો:

એ તો જગજાહેર છે કે જ્યારે કોઈ પોતાની પાસેથી બીજાને આપે છે, બીજાઓની આવશ્યકતાઓ પૂર્ણ કરે છે ત્યારે અન્ય કોઈ તેને પણ આપશે અને તેની આવશ્યકતાઓનું પણ ધ્યાન રાખશે તેથી ઈમામ અલી અ.સ. એ ફરમાવ્યું છે કે: “સદકો આપીને જ આજીવિકામાં વૃદ્ધિની આશા રાખો.” (નહજુલ બલાગાહ, હિકમત નં ૧૩૭)

૪. ઝકાત આપો:

ઈમામ અલી અ.સ. એ ફરમાવ્યું છે કે: “ખુદાવન્દે આલમે મનુષ્ય માટે ઈમાનને શિર્ક (કોઈને-અન્યને ખુદાના સમકક્ષ-સાથીદાર ગણવા)થી પાક રાખવા માટે, નમાઝને અભિમાનથી દૂર રાખવા માટે અને ઝકાતને તેની આજીવિકામાં વૃદ્ધિ માટે રાખેલ છે.” (નહજુલ બલાગાહ, હિકમત નં ૨૫૧)

તકવા ક્યાં ક્યાં કરવો જોઈએ!!

તકવા (પરહેઝગારી)ની બાબતમાં મનુષ્ય સામાન્ય રીતે એવું જ વિચારે છે કે તકવા (પરહેઝગારી) એટલે અલ્લાહથી ડરી જઈને બેસી જવું !!!


પરંતુ એનો આવો અર્થ નથી. તકવા - પરહેઝગારી - અલ્લાહથી ડરવું તે, ખૂબ જ વિશાળ અર્થ ધરાવતો શબ્દ છે અને તે માનવજીવનના દરેક ક્ષેત્ર માટે અત્યંત આવશ્યક બાબત છે. તેથી કુરઆને મજીદમાં તકવા, પરહેઝગારી અને અલ્લાહથી ડરીને ચાલવાની બાબતને બીજા અનેક સદ્ગુણો સાથે સાંકળીને તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે પૈકી કેટલીક બાબતો નીચે મુજબ છે:

૧. ખાવામાં પરહેઝગારી: ઈશ્દિ થએલ છે કે: “ખુદાની હલાલ અને પવિત્ર વસ્તુઓમાંથી ખાઓ અને અલ્લાહથી ડરતાં રહો.” (માએદાહ, ૮૮)
૨. દાન- બીજાઓને આપવામાં પરહેઝગારી: “અલ્લાહે જે કંઈ તમને આપ્યું છે તેમાંથી ખુદાના કાજે ખર્ચ કરતાં રહો (જરૂરિયાતવાળાઓને આપતાં રહો) અને અલ્લાહથી ડરો અને અલ્લાહની નેકીને સાચી માનો અલ્લાહ તે વ્યક્તિના માર્ગને તેના માટે સરળ કરી દેશે.” (લૈલ, ૫-૭)
૩. મસ્જિદનો પાચો પરહેઝગારી ઉપર: ઈશ્દિ થાય છે કે: “એ મસ્જિદ કે જેનો પાચો પ્રથમ દિવસથી જ પરહેઝગારી પર છે તેમાં ઈબાદત કરવી વધુ યોગ્ય છે.” (તૌબા, ૧૦૮)



૪. લોકો સાથે પરહેઝગારી: ઈશાદિ થએલ છે કે: “તમારામાં કોઈ-કોઈની પાછળ નિંદા કરે નહીં, શું તમારામાંથી કોઈ આ (કૃત્ય)ને પસંદ કરે છે કે તે પોતાના મરી ગએલા ભાઈનું માંસ ખાય? નહીં, બલ્કે એ (કૃત્ય) તો તમો બુર જ સમજશો અને અલ્લાહથી ડરો.” (હુજરાત, ૧૨)
૫. વ્યવહારમાં પરહેઝગારી: “હે ઈમાન લાવનારાઓ! પોતાના માલમાં અનેકગણો લાભ (વ્યાજ) ન લો અને અલ્લાહથી ડરતાં રહો.” (આલે-ઈમરાન, ૧૩૦)
૬. વિધર્મીઓ - મુશરિકો સાથેના સબંધોમાં પરહેઝગારી: ઈશાદિ થએલ છે કે: “એક કોમ સાથેની શત્રુતા તમને ન્યાય અને ગુનાહમાં પ્રવૃત્ત ન કરી દે (તેનું ધ્યાન રાખો) અને (હમેશાં) ન્યાય કરતાં રહો કેમકે તે અલ્લાહની બીક અને પરહેઝગારીનું કાર્ય છે અને ગુનાહોથી અંતર રાખો.” (માએદાહ, ૮)
૭. ઉપકાર અને સદ્કાર્યોમાં પરહેઝગારી: “જેમણે સદ્કાર્યો કર્યા અને પરહેઝગારી પૂર્વક વ્યવહાર કર્યો તેમના માટે (તેનો) મહાન બદલો છે.” (આલે ઈમરાન, ૧૭૨)
૮. ઈમાન સાથે પરહેઝગારી: “હે ઈમાન લાવનારાઓ! પરહેઝગાર થઈ જાવ અને સાચાઓ સાથે થઈ જાવ.” (તૌબા ૧૧૯)
૯. રસૂલે ખુદા સ.અ.વ. પ્રત્યેના આદરમાં પરહેઝગારી: ઈશાદિ થએલ છે કે: “જે લોકો (રસૂલે ખુદા સ.અ.વ. સાથે) ધીમા સાદે વાત કરે છે બેશક તેઓ જ એવા લોકો છે કે અલ્લાહે જેમના મનને પરહેઝગારીની બાબતે અજમાવી લીધાં છે અને તેમના માટે ગુનાહોની માફી અને મહાન બદલો છે.” (હુજરાત, ૩)

ઉપરોક્ત આયતો સ્પષ્ટ રીતે એ હકીકત જાહેર કરે છે કે મનુષ્યે પોતાના દરેક કાર્યમાં તકવા - પરહેઝગારી - અલ્લાહની બીકને લક્ષમાં રાખવી જોઈએ જેથી કરીને પરહેઝગારીને કારણે આ જગતમાં સરળતા અને આરામ પ્રાપ્ત થાય. (સૂરએ તલાક, ૨) તેવી જ રીતે બરખાન અને આખેરતમાં પણ શાંતિ અને ફરિશ્તાઓ તરફથી “સલામનું લખાણ” પ્રાપ્ત થાય. (સૂરએ નહલ, ૩૨) અને છેવટે કયામતમાં પણ આપણો અંત સર્વશ્રેષ્ઠ થઈ શકે. (સૂરએ સાદ, ૪૯-૫૦)



કુરઆનની દ્રષ્ટિએ

સદ્કાર્યો અને સદ્ગુણોની અસર

કુરઆને મજુદમાં મનુષ્યના દરેક કાર્ય અને ગુણની ખાસ અસરોનું વર્ણન છે. ઉદાહરણ સ્વરૂપે કેટલીક બાબતો અત્રે રજુ છે:

નમાઝની અસરમાં ગુનાહોથી અંતર થાય છે તેવું જણાવવામાં આવ્યું છે. તેથી જ ઈશાદિ થએલ છે કે: નિ:શંક રીતે નમાઝ મનુષ્યને ગુનાહોથી દૂર કરી દે છે અને દુષ્ટ કાર્યોથી અટકાવે છે. (સૂરઅ અન્કબૂત ૪૫)

આમ મનુષ્ય નમાઝ પઢતી વખતે ઘણા ભૂંડા કાર્યો અને અપ્રિય વાતોથી દૂર રહે છે.

રોઝા મનુષ્યમાં પરહેઝગારી પેદા કરે છે. તેથી જ રોઝા પાછળનો ઉદ્દેશ જણાવીને પરવરદિગાર ફરમાવે છે: “અગાઉના લોકોની જેમ તમારા માટે પણ રોઝાને નિયત કરી દેવામાં આવ્યાં છે, કદાચ (તેને કારણે) તમો પરહેઝગાર બની જાવ.” (સૂરઅ બકરાહ ૧૮૩)

ઝકાતના પરિણામે ભૌતિક વસ્તુઓના બિનજરૂરી મોહમાંથી મનુષ્ય મુક્ત થઈ જાય છે. તેથી જ નબીયે અકરમ સ.અ.વ.ને ઝકાતો (સદકો) લેવા (ઉઘરાવવા)ની આજ્ઞા કરતી વખતે અલ્લાહ તઆલાએ ફરમાવ્યું છે:

“તેમના ધન (માલ)માંથી થોડુંક લઈ લો જેથી કરીને આપ તેમને પવિત્ર-શુદ્ધ અને મનોવૈજ્ઞાનિક રીતે (આંતરિક રીતે-અંતરથી) અતિશુદ્ધ બનાવી શકો.” (તૌબા ૧૦૩)

અતિશુદ્ધ પ્રાયશ્ચિત (તૌબા)નું પરિણામ એ આવે છે કે તેનાથી મનુષ્યના સઘળા ગુનાહો (પાપ) નાશ પામે છે. તેથી પરવરદિગારે આલમે ફરમાવ્યું છે: “તમો લોકો અતિશુદ્ધ પ્રાયશ્ચિત (ખાલિસ તૌબા) કરતાં રહો અને આશા છે કે તમારો પરવરદિગાર તેના થકી તમારા ગુનાહોને ક્ષમા કરી દેશે.” (સૂરઅ તહેરીમ ૮)

કર્મે હસના (વ્યાજ વગરની લોન - કરજ) આપવું તે અલ્લાહ તરફથી ગુનાહોને માફ કરવાનું કારણ બને છે. તેથી જ પરવરદિગારે ફરમાવ્યું છે કે: “જો તમો અલ્લાહને કર્મે હસના (એટલે કે ખુદાની રાહમાં ખર્ચ કરશો અથવા અલ્લાહના નામે કોઈ વ્યક્તિને વ્યાજ વગર કરજ-લોન આપશો) ત્યારે તમે જે આપશો તેને બમણું કરી દેવામાં આવશે અને તમને (તમારા ગુનાહોને) માફ કરી દેવામાં આવશે.” (તગાબુન ૧૭)

પયગમ્બર સ.અ.વ.ના કાયદા-કાનૂનો (આજ્ઞાઓ) પ્રમાણે અમલ કરવો તે અલ્લાહના પ્રિય પાત્ર બનવાનું કારણ બને છે. તેથી જ ઈશ્દિ થએલ છે કે: “હે નબી સ.અ.વ.! આપ લોકોને જણાવી દો કે જો તમો ખુદાને પ્રેમ કરતાં હોવ તો માફ અનુકરણ અને માફ આજ્ઞાપાલન કરો જેથી કરીને ખુદા પણ તમને પોતાના નાપ્રિય પાત્ર ગણે અને તમારા ગુનાહોને માફ કરી દે.” (આલે-ઇમરાન ૩૧)

ઈમાન અને સદ્કાર્યોનું પરીણામ એ પ્રાપ્ત થાય છે કે મનુષ્ય લોકોમાં પ્રિતિ પાત્ર થઈ જાય છે. તેથી ફરમાવવામાં આવ્યું છે કે: “નિઃશંક પણ જે લોકો ઈમાન લાવ્યાં અને

સદ્કાર્યો કરે છે (તેથી) નજીકના ભવિષ્યમાં જ દયાળુ ખુદા તેમના માટે લોકોના મનમાં પ્રેમની ભાવના ઉત્પન્ન કરી દેશે.” (મરયમ ૯૬)

કયામતને યાદ કરતાં રહેવાથી મનુષ્યમાં નિઃસ્વાર્થતા અને નિખાલસતાની ભાવના આવી જાય છે. તેથી અલ્લાહ આવા લોકો માટે ફરમાવે છે કે: “એમાં શંકાને સ્થાન નથી કે અમે તેમના સદ્ગુણને કારણે નિઃસ્વાર્થી અને નિખાલસ બનાવી દીધાં અને તે ગુણ આખેરતને યાદ કરતાં રહેવું તે છે.”

અલ્લાહના ઉપકારોનો પાડ માનવાનું પરિણામ એ આવે છે કે તેનાથી મનુષ્ય ઉપર અલ્લાહની નેઅમતો (દયા-કૃપા)માં વૃદ્ધિ થાય છે. આ અંગે ખૂબ જ પ્રખ્યાત આયત છે કે: “જો તમો મારો પાડ માનતા રહેશો તો તમારા ઉપરની (મારી) નેઅમતો (દયા-કૃપા)માં હું વૃદ્ધિ કરી દઈશ.” (ઇબ્રાહીમ ૭)

ખુદાની યાદ (સ્મરણ)ના પરિણામે મનુષ્યના મનને સાંત્વના (શાંતિ) મળે છે. આ અંગે અલ્લાહ તઆલાએ ફરમાવ્યું છે કે: “જાણી લો કે ખુદાનો ઝિંક (સ્મરણ-યાદ) મનને સાંત્વના અને આરામ આપે છે.” (સૂરએ રઅદ ૨૮)

જુમ્આની નમાઝ -ઈબ્રાહિમ અને રાજનીતિનો વર્ગ-

કુરઆન મજીદ

કુરઆન મજીદમાં ફરમાવ્યું છે કે: “હે ઈમાન લાવનારાઓ! જ્યારે તમને જુમ્આની નમાઝ માટે પોકારવામાં આવે ત્યારે અલ્લાહના ઝિક્ર માટે દોડી જાવ અને ખરીદ-વેચાણ તજી દો. જે તમો આ બાબતોથી જાણકાર હોવ તો આ તમારા માટે સારું (લાભદાયી કાર્ય) છે.” (સૂરએ જુમ્આ, આયત ૯)

હદીસો

રસૂલે ખુદા સ.અ.વ. એ ફરમાવ્યું છે કે: “શું તમને એ જણાવું કે જન્નતમાં જનાર લોકો કોણ છે? (તો જાણી લો કે) જન્નતમાં જનાર લોકો એ છે કે જેમને અત્યંત વધારે શરદી અને ઘોમ ઘખતો તાપ અને પથરાળ-ઉબડખાબડ (ચાલવા માટે દુષ્કર હોય તેવો) માર્ગ પણ નમાઝે જુમ્આમાં શામેલ થવાથી બાધક બની શકે નહીં” (કન્ઝુલ ઉમ્માલ, હદીસ નં ૨૧૦૮૫)

حی علی الصلاة

نماز جمعہ



ઈમામ રિઝા અ.સ. એ ફરમાવ્યું છે કે: “નમાઝમાં ખુટા (સંબોધન)નું પ્રાવધાન એટલા માટે કરવામાં આવ્યું છે કે આ પ્રસંગે બધાં લોકો એકત્ર થતાં હોય છે તેથી અમીર (ખતીબ-સંબોધન કરનાર) તે સંબોધન થકી લોકોને શિખામણ આપે છે અને લોકોને અલ્લાહની તાબેદારી અને આજ્ઞાંકિતતા પ્રત્યે પ્રેરિત કરે છે અને ગુનાહોથી ડરાવે છે અને દીન અને દુન્યાની ભલાઈ વિશે પોતાના વિચારોની લોકોને જાણકારી આપે છે અને જગતના એવા સમાચારો કે લોકો માટે લાભદાયક હોય અને જે બાબતો લોકોને નુકશાન પહોંચાડનારી સાબિત થઈ શકે તેનાથી લોકોને જાણકાર કરે છે.” (વસાએલુશ્શીઆ, ભા ૫, પા ૩૯, ૬ ૬)


ઈમામ અલી અ.સ. એ ફરમાવ્યું છે કે: ત્રણ બાબતોમાં જે તમે પોતાના દીની શાસક (દીની હાકેમ)નો વિરોધ કરશો તો તમો નષ્ટ થઈ જશો: ૧. નમાઝે જુમ્આ, ૨. શત્રુઓ સાથે ધર્મયુધ્ધ (જિહાદ) અને ૩. હજના મનાસિક અદા કરવા.

(અલ-જાઅફરિયાત, પા ૫૨)













حجی علی الصلوة

نماز جمعہ




જુઓ અને ચિત્ર બનાવો



નીચે આપેલ ચિત્રમાં મનગમતાં રંગ પૂરો:



આઈ ગેઝેટી






₹/. 30

ISSUED BY THE SSPO's AHMEDABAD CITY DIVISION, PERMITTED TO POST AT AHMEDABAD PSO ON 10TH OF EVERY MONTH

865/866, BEHIND TASLIM SOCIETY, NEAR GOLDEN PARK, VATVA, AHMEDABAD - 382 440



**PRINTED AND PUBLISHED BY: RIZVI MOHMED RAZA ABID HUSEIN ON BEHALF OF
HAUZA-E-ILMIYAH IMAM KHOMAINI CHARITABLE TRUST, RNI NO: GUJGUJ/2015/59960
AND PRINTED AT PRINT CARE, N.R. ESTATE, TAVDIPURA, SHAHIBAUG, AHMEDABAD-380 004
AND PUBLISHED FROM HAUZA-E-ILMIYAH IMAM KHOMAINI CHARITABLE TRUST
865/866, BEHIND TASLIM SOCIETY, NEAR GOLDEN PARK, VATVA, AHMEDABAD- 382 440
EDITOR: RIZVI MOHMED RAZA ABID HUSEIN**

